

પ્રેઝન્ટર

હેલ્લો એન્ડ વેલકમ English Togetherમાં આપનું સ્વાગત છે...હું છું રીષી...અને આજે મારી સાથે છે...

**Sam**

Hello, I'm Sam.

**Phil**

Hi, I'm Phil.

પ્રેઝન્ટર

મિત્રો, આજે વાત કરવી છે એવા વિષય ઉપર જેને હાલમાં સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી છે. અને એ છે પ્લાસ્ટિક બોટલનું ઉત્પાદન અને વ્યવસ્થાપન. અમેરિકાની એનજીઓ કન્ટેનર રિસાયક્લિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં એ જાણવાની કોશિશ થઈ કે અમેરિકામાં દરરોજ કેટલી પ્લાસ્ટિકની બોટલો ફેંકવામાં આવે છે. તો મિત્રો, તમારા મતે એ આંકડો શું હોઈ શકે? તમારા ઓપ્શન છે:

અ) 10 મિલિયન

બ) 20 મિલિયન

ક) 60 મિલિયન

અમે તમને આ સવાલનો જવાબ થોડીવારમાં જાણાવીશું.

**Sam**

Wow, those numbers are huge!

**Phil**

Well, there are a lot of thirsty people out there! What else are they supposed to drink?

પ્રેઝન્ટર

એકદમ સાચી વાત. શું તમને ખબર છે મિત્રો કે ભારત 90% પ્લાસ્ટિક બોટલોનું રિસાયક્લિંગ કરે છે? આ વાત બહાર આવી છે એક અભ્યાસ થકી જે Council of Scientific and Industrial Research (CSIR) અને National Chemical Laboratory (NCL) દ્વારા કરવામાં આવ્યો છે. યુ.કે. માં શું પરિસ્થિતિ છે?

**Sam**

Well, almost every shop in the UK sells cheap, bottled water. People drink a lot of it. Water is also much cheaper than sugared drinks, so many people think this is a good way of helping to stop obesity.

પ્રેઝન્ટર

હા, 'obesity' એટલે સ્થૂળતા. And sugar can certainly cause obesity...but we still have a lot of bottles! આજે તમે BBC current affairs program, You and Yours, દ્વારા કરવામાં આવેલ ન્યૂઝ સાંભળી જેમાં પ્લાસ્ટિક બોટલ, પીણું, આરોગ્ય અને પર્યાવરણ વિશે વાત કરવામાં આવી છે.

Radio presenter

This is a perfect illustration of the range of bottled water you can buy these days. I'm in a medium-sized and supermarket and I've just counted twenty-two different brands of bottled water on the shelves in front of me; that's not including the supermarket's own brand and it's not including the various flavoured waters you can find. Supporters say the rise of bottled water is good for the economy and has manifest health benefits over sugared drinks, which have been blamed for the obesity epidemic. But environmentalists say it's wasteful, and that most plastic bottles are never recycled.

Sam: It sounds like we might not think enough about the consequences of the bottles we use.

પ્રેઝન્ટર

I agree, Sam. 'Consequences એટલે પરિણામ. You can see a lot of these consequences here. Like large amount of plastic trash at beaches and public places.

**Sam**

Yeah, you can find plastic bottles almost anywhere, now! I think that, as well as air pollution, plastic pollution is becoming a real issue!

પ્રેઝન્ટર

'Pollution' એટલે પ્રદૂષણ. What do you think, Phil?

**Phil**

I agree that pollution is a big issue. But what are people supposed to do? I mean, I'm a big consumer of fizzy drinks. I can't buy a bottle made of paper, can I? It would fall to pieces!

પ્રેઝન્ટર

'Fizzy drinks' એટલે નોન-આલ્કોહોલિક, ફ્લેવર્ડ, કાર્બોનેટેડ પીણું. Yes, but there must be other materials we can use?

**Sam**

Yeah! Something degradable would be better as it wouldn't cause such a mess for so long!

પ્રેઝન્ટર

Yes! 'Degradable' એટલે રાસાયણિક અથવા જૈવિક રીતે પદાર્થનાઘટકો છૂટાં પાડવા સક્ષમ. Don't you think it would be better to have bottles made of degradable material, Phil? Especially if people drink as many fizzy drinks as you do!

**Phil**

Well, I agree, it's probably a good idea, but you're also forgetting that people can reuse plastic, too!

પ્રેઝન્ટર

'Reuse' એટલે ફરી ઉપયોગ કરવું. Perhaps you're right, Phil. આ વાત સાથે હું તમને આજના પ્રશ્નનો જવાબ જણાવું. પ્રશ્ન હતો કે અમેરિકામાં દરરોજ કેટલી પ્લાસ્ટિકની બોટલો ફેંકવામાં આવે છે. તો મિત્રો, જવાબ છે: ૬) 60 મિલિયન બોટલો.

**Sam**

Oh wow! I can't believe it, that's so depressing. It's really bad for the environment!

પ્રેઝન્ટર

'Environment' એટલે વાતાવરણ. You are right Sam!

**Phil**

Ok, right! I'm going to reuse this bottle! So, where's the fizzy drinks tap?

પ્રેઝન્ટર

Fizzy drinks?!

**Sam**

You can't get free fizzy drinks from the tap, Phil!

**Phil**

What?! Why not?! That's ridiculous! I think I'm going to the shop now to buy a nice, cold bottle of lemonade. Does anyone want anything?

**Sam**

Phil, wait! Think about what you're doing!!

પ્રેઝન્ટર

ઓહ, આ બન્ને પણ ખરાં છે! મને લાગે છે કે ફિલને ઘણી તરસ લાગી છે. તમારો અભિપ્રાય જણાવો મિત્રો. શું તમે પ્લાસ્ટિકનાં બોટલોને 'reuse' અથવા 'recycle' કરો છો. શું તમે જે જગ્યાએ રહો છો ત્યાં 'pollution' અને 'obesity' જેવી સમસ્યાઓ છે?

પ્લાસ્ટિકની બોટલો કામની વસ્તુ છે કે પછી એ વાતાવરણ માટે હાનિકારક છે? તમને શું લાગે છે? અમારા ફેસબુક પેજમાં જોડાવો અને તમારા પ્રતિભાવ જણાવો. પ્લાસ્ટિકનાં બોટલો કે જે 'degradable' નથી એના

'consequences' એટલે કે પરિણામો વિશે વાત કરવા આજે પણ બીજા શબ્દભંડોળનો ઉપયોગ કર્યો છે.

મિત્રો, 'degradable' એટલે કે 'રાસાયણિક અથવા જૈવિક રીતે પદાર્થનાઘટકો છૂટાં પાડવા સક્ષમ.'

આવાં જ બીજા રસપ્રદ ટોપિક સાથે ફરીથી મળીશું English Together માં. ત્યાં સુધી Bye!

